



આ પત્ર નીચેની ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે: અંગ્રેજી, અરબી, સરળ યાઇનીઝ, પરંપરાગત યાઇનીઝ, ફારસી, ગુજરાતી, હીબ્રુ, કોરિયન, પંજાબી, રશિયન, તમિલ, તુર્કી, ઉર્દૂ અને વિયેતનામી.

YRDSB 2021-22 વિદ્યાર્થી અને કુટુંબ અંગેના સર્વેક્ષણો

પ્રિય માતાપિતા/સહાયકર્તા:

વિદ્યાર્થી અને કુટુંબ ની જાણકારી અમારા માટે મહત્વપૂર્ણ છે. યોર્ક રિજન ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ વિદ્યાર્થીઓ (ગ્રેડ 7-12) અને પરિવારો (ગ્રેડ K-12) સાથે જૂન 1 - 30, 2022 ની વચ્ચે સ્કૂલ માં આ વર્ષના શીખવાના અનુભવોને વધુ સારી રીતે સમજવા માટે ઓનલાઇન સર્વેક્ષણ કરશે. સર્વેક્ષણ કરવામાં લગભગ 20 મિનિટનો સમય લાગશે.

સર્વેક્ષણમાં આ અંગેના પ્રશ્નોનો સમાવેશ થશે:

- શીખવાના મોડલ, ટેકનોલોજી અને શીખવાના સાધનો
- જોડાણ અને શિક્ષણ
- કુટુંબ/શાળા સંચાર અને સમુદાય સંલગ્નતા
- સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય
- સાથીદારો અને સ્ટાફ સાથેના સંબંધો
- સલામતી, ભેદભાવ અને ધાક-ધમકીઓ
- સમાન અને સમાવિષ્ટ રીતનું શૈક્ષણિક વાતાવરણ
- વિદ્યાર્થીની ઓળખ

વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે શીખવાના અનુભવો કેવી રીતે અલગ હોઈ શકે છે તે સમજવા માટે અમે વિદ્યાર્થીઓની ઓળખ (દા.ત. જાતિ અને લિંગ) વિશે પ્રશ્નો પૂછીએ છીએ. સર્વેક્ષણોના પરિણામો સ્કૂલ વર્ષ 2022-23 દરમિયાન ટ્રસ્ટીઓ, સ્કૂલો, બોર્ડ વિભાગો અને લોકો સાથે શેર કરવામાં આવશે.

એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ આ લાભાર્થે કરવામાં આવશે:

- વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવા માટે.
- તંદુરસ્ત, સમાવિષ્ટ અને સમાન શિક્ષણ અને કાર્યકારી વાતાવરણ બનાવવા માટે પ્રણાલીગત અવરોધોને ઓળખવા માટે.

- સમાવિષ્ટ, આવકારદાયક અને સહાયક વાતાવરણનું નિર્માણ યાલુ રાખવા માટે પ્રોગ્રામ્સ બનાવવા, પ્રાથમિકતાઓ સેટ કરવા અને સંસાધનો વિકસાવવા માટે જ્યાં બધાને લાગે છે કે તેઓ મહત્વપૂર્ણ છે અને સાથે જોડાયેલ છે.

કૌટુંબિક સર્વે અંગ્રેજી, અરબી, સરળ યાઇનીઝ, પરંપરાગત યાઇનીઝ, ફારસી, ગુજરાતી, હીબ્રુ, કોરિયન, પંજાબી, રશિયન, તમિલ, તુર્કી, ઉર્દૂ અને વિયેતનામી ભાષાઓમાં ઓનલાઇન ઉપલબ્ધ થશે.

વિવિધ અસાધારણતા ધરાવતા સહભાગીઓને સમાવવા માટે, ગુગલ રીડ એન્ડ રાઈટ નામના જેવા અવાજ ઓળખવા માટેના સોફ્ટવેરનો ઉપયોગ કરીને કુટુંબ અને વિદ્યાર્થી અંગેના - એમ બંને સર્વેક્ષણો પૂર્ણ કરી શકાય છે. સર્વેક્ષણમાંના પ્રશ્નો સ્ક્રીન રીડર સાથે સુસંગત છે. તમારા સંદર્ભ માટે, વિદ્યાર્થી અને કુટુંબ સર્વેક્ષણો ના સર્વેની નકલો [બોર્ડની વેબસાઇટ](#) પર ઉપલબ્ધ છે.

સર્વેક્ષણો અનામી અને ગોપનીય છે. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ અને પરિવારોને તેમના નામ માટે પૂછવામાં આવશે નહીં, અને વ્યક્તિગત પ્રતિસાદોની જાણ કરવામાં આવશે નહીં. સર્વેક્ષણો **સ્વૈચ્છિક** છે અને ઉત્તરદાતાઓ તેઓ જવાબ આપવા માંગતા ન હોય તેવા કોઈપણ પ્રશ્નોને છોડી શકે છે.

આ સર્વેક્ષણોમાં પૂરી પાડવામાં આવેલ માહિતી ફક્ત YRDSB ના સંશોધન અને મૂલ્યાંકન સેવા વિભાગના સ્ટાફ દ્વારા જ સુલભ હશે. અમે જે તૃતીય પક્ષ ડેટા એકત્રીકરણ સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે પ્રતિસાદો પણ સુલભ હશે જ્યાં સુધી સંશોધન અને મૂલ્યાંકન સેવાઓ સર્વેક્ષણો બંધ થયા પછી તેમને દૂર ન કરે. ડેટાનો સંગ્રહ અને જાળવણી અનુસરશે [બોર્ડ નીતિ અને પ્રક્રિયા #160.0 રેકોર્ડ્સ અને માહિતી વ્યવસ્થાપન](#).

ઘોરણ 7-12 ના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સર્વેક્ષણમાં ભાગ લેવા માટે તેમના GAPPS સ્કૂલ ખાતામાં એક ઇમેઇલ આમંત્રણ પ્રાપ્ત થશે અને સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે તેમને 1 જૂન અને 30 જૂન વચ્ચે વર્ગમાં સમય આપવામાં આવશે. જો તમે ઘોરણ 7-12માં રહેલા તમારા બાળક(બાળકો)ને વિદ્યાર્થી સર્વેક્ષણ આમંત્રણ પ્રાપ્ત કરવા માંગતા નથી અથવા જો તમને સર્વેક્ષણ વિશે પ્રશ્નો હોય, તો કૃપા કરીને સંપર્ક કરો research.services@yrdsb.ca **26 મે, 2022 પછી નહીં**. માતા-પિતા/વાલીઓને તેમના બાળકની સ્કૂલમાં રહેલ ફાઇલ પરના ઇમેઇલ સરનામાં દ્વારા કૌટુંબિક સર્વેક્ષણ પૂર્ણ કરવા માટેનું આમંત્રણ પ્રાપ્ત થશે.

આ મહત્વપૂર્ણ પહેલ જેમ અમે વિદ્યાર્થીઓ અને પરિવારોની વિવિધ જરૂરિયાતો પૂરી પાડવાનું યાલુ રાખવા માટે તેમના અભિપ્રાયો સાંભળવા માટે સાથે મળીને કામ કરીશું તેમ અમારા દ્વીષ્ટિકોણને આગળ વધારવામાં મદદ કરશે. તમારા સહકાર બદલ આભાર.